

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સીધી ભરતી સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા “કચેરી અધિક્ષક / કાર્યાલય અધિક્ષક / અધિક્ષક” વર્ગ-૩ સંવર્ગની માટે તા.૧૭-૧૦-૨૦૧૭ ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૪૨/૨૦૧૭૧૮ અને જાહેરાત ક્રમાંક: ૧૪૩/૨૦૧૭૧૮ પ્રસિધ્ધ કરી તા.૦૨-૧૧-૨૦૧૭ થી તા.૧૮-૧૧-૨૦૧૭ અને તા.૨૪-૧૧-૨૦૧૭ થી તા.૨૫-૧૧-૨૦૧૭ તથા ત્યારબાદ સરકારશ્રીની સૂચનાઓ ધ્યાને લઈને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે તે માટે તેમજ અગાઉ ઓન લાઇન અરજી કરેલ નથી તેવા તમામ કેટેગરીના ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે તે માટે ઓન-લાઇન અરજીપત્રકોના રજીસ્ટ્રેશન માટે તા.૦૧-૦૬-૨૦૧૮ના રોજ સુધારા જાહેરાત પ્રસિધ્ધ કરીને તા.૦૧-૦૬-૨૦૧૮ થી તા.૩૦-૦૬-૨૦૧૮ દરમ્યાન ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ હતા. ઉક્ત અરજી અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને General કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?) ને અંતે નીચે દર્શાવેલ સંવર્ગોમાં લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની MCQ – OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી ગાંધીનગર / અમદાવાદ ખાતેના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે.

અ. નં.	જાહેરાત ક્રમાંક	સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ
૧.	૧૪૨/૨૦૧૭૧૮	કાર્યાલય અધિક્ષક	૨૯-૧૨-૨૦૧૮
૨.	૧૪૩/૨૦૧૭૧૮	કચેરી અધિક્ષક / કાર્યાલય અધિક્ષક / અધિક્ષક	૨૯-૧૨-૨૦૧૮

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનો સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ તેમજ ૨૬ થયેલ અરજીપત્રકોની વિગતો ((૧) પરીક્ષા ફી ન ભરવાના કારણસર અને (૨) એક કરતાં વધુ અરજી કરેલ હોય તેવા કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક ગ્રાહ્ય રાખીને બાકીના અરજીપત્રકો ડુપ્લીકેશનના કારણસર ૨૬ ગણવામાં આવેલ છે તેવા અરજીપત્રકોની) પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે.

તારીખ : ૨૬ / ૧૧ / ૨૦૧૮

સ્થળ : ગાંધીનગર

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ